



JAX-1601300102030500 Seat No. _____

M. A. (Sem. III) (CBCS) (W.E.F. 2016) Examination

December - 2019

Geography : Paper - 11
(Climatology) (New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

સૂચના : (1) બધા પ્રશ્નો ફરજિયાત છે.
(2) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.

- | | | |
|-------------|--|----|
| 1 | આબોહવા શાસ્ત્રની વ્યાખ્યા આપી, તેનું કાર્યક્ષેત્ર વિગતે સમજાવો. | 14 |
| અથવા | | |
| 1 | પૃથ્વી સપાટી પરના સૂર્યાધાતના વિતરણ પર અસર કરતાં પરિબળોની વિગતે ચર્ચા કરો. | 14 |
| 2 | વાતાવરણીય દબાણ એટલે શું ? દબાણ પર અસર કરતાં પરિબળો વિગતે સમજાવો. | 14 |
| અથવા | | |
| 2 | ધની ભવન એટલે શું ? તેના વિવિધ સ્વરૂપોની વિગતે ચર્ચા કરો. | 14 |
| 3 | વર્ષણી પ્રક્રિયા વિગતે સમજાવી, તેના સ્વરૂપોની ચર્ચા કરો. | 14 |
| અથવા | | |
| 3 | 'કોપેન'ના આબોહવાના વર્ગીકરણની વિસ્તૃત ભૌગોલિક માહિતી આપો. | 14 |
| 4 | વાયુ સમુચ્ચ્યોના ઉદ્ભબ, સ્વરૂપ અને મુખ્ય લક્ષણો વિગતવાર વર્ણવો. | 14 |
| અથવા | | |
| 4 | બદલાતી આબોહવા એટલે શું ? વિશ્વની બદલાતી આબોહવામાં માનવીનો ફાળો વિગતે સમજાવો. | 14 |
| 5 | નીચેનામાંથી કોઈપણ બે પર નોંધ લખો : | 14 |
| | (1) પૃથ્વીનું ગરમી બજેટ | |
| | (2) દબાણ પણ્ઠાઓ | |
| | (3) ઉષ્ણકટિબંધીય ચકવાતો | |
| | (4) આબોહવાશાસ્ત્રની વ્યવહારિકતા. | |

ENGLISH VERSION

Instructions : (1) All questions are compulsory.
(2) Draw neat diagram wherever necessary.

1 Give the definition of Climatology and explain in detail its scope. **14**

OR

1 Explain in detail the factors influencing the distribution of insolation on the earth surface. **14**

2 What is atmospheric pressure ? Explain in detail the factor effecting the pressure. **14**

OR

2 What is condensation ? Discuss in detail the various forms of its. **14**

3 Explain in detail the process of precipitation and discuss its forms. **14**

OR

3 Give a detailed geographical information of the 'Koppen's' classification of climate. **14**

4 Describe in detail the origin, nature and main characteristics of airmasses. **14**

OR

4 What is climate change ? Explain in detail the role of man for the global climate change. **14**

5 Write notes on any **two** of the following : **14**

- (1) Heat budget of the earth.
 - (2) Pressure belts.
 - (3) Tropical Cyclones.
 - (4) Applied climatology.
-